

**GUJARAT TECHNOLOGICAL UNIVERSITY**  
**Diploma Engineering - SEMESTER – I • EXAMINATION – WINTER 2012**

**Subject code: 310034****Date: 08/01/2013****Subject Name: Mathematics-I****Time: 02.30 pm - 05.00 pm****Total Marks: 70****Instructions:**

1. Attempt any five questions.
2. Make suitable assumptions wherever necessary.
3. Figures to the right indicate full marks.
4. English version is considered to be Authentic

<b>Q.1</b>	(a) Fill in the Blanks	<b>10</b>
	(1) $\log_2 8 =$ _____	
	(2) If $\log x + \log 2x = \log 18$ then $x =$ _____	
	(3) The geometric mean of 3 and 12 = _____	
	(4) If 0.1, 1 and c are in G.P. then $c =$ _____	
	(5) If $5C_3 = 5C_r$ and $r \neq 3$ then $r =$ _____	
	(6) No of terms in the expansion of $\left(x + \frac{1}{x}\right)^5 =$ _____	
	(7) $\sin^2 \theta + \cos^2 \theta =$ _____	
	(8) $\sin(180^\circ + \theta) =$ _____	
	(9) $\sin^{-1} x +$ _____ $= \frac{\pi}{2}$	
	(10) Period of $\sin(2x+3) =$ _____	
(b)	Prove that $\frac{1}{\log_2 6} + \frac{1}{\log_3 6} = 1$	<b>02</b>
(c)	For G.P. 1,3,9,..... if $T_n = 2187$ then find n.	<b>02</b>
<b>Q.2</b>	(a) (1) Prove that $\log_a x + \log_{a^2} x^2 + \log_{a^3} x^3 + \log_{a^4} x^4 = 4 \log_a x$	<b>04</b>
	(2) Prove that $\frac{1}{\log_6 24} + \frac{1}{\log_{12} 24} + \frac{1}{\log_8 24} = 2$	<b>03</b>
(b)	(1) Find the sum of first n terms of 3+33+333+.....	<b>04</b>
	(2) Find three geometric mean between 6 and 486	<b>03</b>
<b>Q.3</b>	(a) (1) Find the coefficient of $x^6$ in the expansion of $\left(\frac{3x^2}{2} - \frac{1}{3x}\right)^9$	<b>04</b>
	(2) Find the middle term in the expansion of $\left(\frac{x^2}{2} - \frac{2}{x}\right)^8$	<b>03</b>
(b)	(1) If $A = \begin{bmatrix} 1 & 2 & 2 \\ 2 & 1 & 2 \\ 2 & 2 & 1 \end{bmatrix}$ then show that $A^2 - 4A - 5I = 0$ .	<b>04</b>

(2) If  $A = \begin{bmatrix} 1 & 2 & 1 \\ -1 & 3 & 2 \\ 0 & 1 & -1 \end{bmatrix}$ ,  $B = \begin{bmatrix} -1 & -2 & 1 \\ 0 & 1 & -1 \\ -2 & 2 & 2 \end{bmatrix}$  and  $C = \begin{bmatrix} -2 & 1 & 2 \\ 0 & 1 & 0 \\ 4 & 3 & 1 \end{bmatrix}$  then find  $2A-B+C$ . 03

**Q.4** (a) (1) If  $A = \begin{bmatrix} 1 & -1 & 1 \\ 2 & -1 & 0 \\ 1 & 0 & 1 \end{bmatrix}$  then find  $A^{-1}$ . 04

(2) Solve the given equations using matrix method,  $3x-y=1$  and  $x+2y=5$ . 03

(b) (1) A particle moves from  $(-1,2,1)$  to  $(2,3,-1)$  under the effect of the forces  $(1,2,1)$  and  $(2,-1,0)$ . Find the work done. 04

(2) If  $\bar{a} = (1,1,1)$ ,  $\bar{b} = (2,1,2)$ ,  $\bar{c} = (-1,0,3)$  then find  $|2\bar{a} + \bar{b} - \bar{c}|$  03

**Q.5** (a) (1) Find unit vector perpendicular to  $\bar{a} = (3,1,2)$  and  $\bar{b} = (2,-2,4)$  04

(2) Find the angle between the vectors  $\bar{a} = (1,2,4)$  and  $\bar{b} = (3,1,2)$  03

(b) (1) Prove that  $\cot \frac{\pi}{20} \cot \frac{3\pi}{20} \cot \frac{5\pi}{20} \cot \frac{7\pi}{20} \cot \frac{9\pi}{20} = 1$  04

(2) prove that  $\frac{\sec \theta + 2 \sin \theta}{\sin \theta + \cos \theta} = 1 + \tan \theta$  03

**Q. 6** (a) (1) Draw the graph of  $y = \sin x$ ,  $-\frac{\pi}{2} \leq x \leq \frac{\pi}{2}$  04

(2) Simplify  $\frac{\sin\left(\frac{\pi}{2}-\theta\right)}{\cos(\pi-\theta)} + \frac{\tan\left(\frac{\pi}{2}+\theta\right)}{\cot(\pi+\theta)} + \frac{\operatorname{cosec}\left(\frac{\pi}{2}+\theta\right)}{\sec(\pi+\theta)}$  03

(b) (1) Prove that  $\cos A \sin(B-C) + \cos B \sin(C-A) + \cos C \sin(A-B) = 0$  04

(2) Prove that  $\frac{1 + \sin 2A - \cos 2A}{1 + \sin 2A + \cos 2A} = \tan A$  03

**Q. 7** (a) (1) Draw the graph of  $y = \cos x$ ,  $0 \leq x \leq \pi$  04

(2) Prove that  $\frac{\cos A + \cos 3A + \cos 5A}{\sin A + \sin 3A + \sin 5A} = \cot 3A$  03

(b) (1) For acute angled  $\Delta ABC$  prove sine rule in standard notations. 04

(2) Prove that  $\tan^{-1}\left(\frac{1}{3}\right) + \tan^{-1}\left(\frac{1}{7}\right) = \tan^{-1}\left(\frac{1}{2}\right)$  03

\*\*\*\*\*

**Q.1** (a) ખાતી જગ્યાપૂરો

10

- (1)  $\log_2 8 = \underline{\hspace{2cm}}$
- (2) જો  $\log x + \log 2x = \log 18$  તો  $x = \underline{\hspace{2cm}}$
- (3) 3 અને 12 નો સમગુણોત્તર મધ્યક =  $\underline{\hspace{2cm}}$
- (4) જો 0.1, 1 અને c G.P. મા હોય તો c =  $\underline{\hspace{2cm}}$
- (5) જો  $5C_3 = 5C_r$  અને  $r \neq 3$  તો r =  $\underline{\hspace{2cm}}$
- (6)  $\left( x + \frac{1}{x} \right)^5$  ના વિસ્તરણમા કુલ પદની સંખ્યા =  $\underline{\hspace{2cm}}$
- (7)  $\sin^2 \theta + \cos^2 \theta = \underline{\hspace{2cm}}$
- (8)  $\sin(180^\circ + \theta) = \underline{\hspace{2cm}}$
- (9)  $\sin^{-1} x + \underline{\hspace{2cm}} = \frac{\pi}{2}$
- (10)  $\sin(2x+3)$  નું આવર્તમાન =  $\underline{\hspace{2cm}}$

(b) સાબિત કરો કે  $\frac{1}{\log_2 6} + \frac{1}{\log_3 6} = 1$

02

(c) G.P. 1, 3, 9, ..... માટે  $T_n = 2187$  તો n શોધો.

02

**Q.2** (a) (1) સાબિત કરો કે  $\log_a x + \log_{a^2} x^2 + \log_{a^3} x^3 + \log_{a^4} x^4 = 4 \log_a x$

04

(2) સાબિત કરો કે  $\frac{1}{\log_6 24} + \frac{1}{\log_{12} 24} + \frac{1}{\log_8 24} = 2$

03

(b) (1) 3+33+333+..... ના પ્રથમ n પદોનો સરવાળો શોધો.

04

(2) 6 અને 486 વચ્ચે ત્રણ સમગુણોત્તર મધ્યક મેળવો.

03

**Q.3** (a) (1)  $\left( \frac{3x^2}{2} - \frac{1}{3x} \right)^9$  ના વિસ્તરણમા  $x^6$  નો સહગુણક શોધો.

04

(2)  $\left( \frac{x^2}{2} - \frac{2}{x} \right)^8$  ના વિસ્તરણનું મધ્યમપદ શોધો.

03

(b) (1) જો  $A = \begin{bmatrix} 1 & 2 & 2 \\ 2 & 1 & 2 \\ 2 & 2 & 1 \end{bmatrix}$  તો બતાવો કે  $A^2 - 4A - 5I = 0$ .

04

(2) જો  $A = \begin{bmatrix} 1 & 2 & 1 \\ -1 & 3 & 2 \\ 0 & 1 & -1 \end{bmatrix}, B = \begin{bmatrix} -1 & -2 & 1 \\ 0 & 1 & -1 \\ -2 & 2 & 2 \end{bmatrix}, C = \begin{bmatrix} -2 & 1 & 2 \\ 0 & 1 & 0 \\ 4 & 3 & 1 \end{bmatrix}$  તો

03

$2A - B + C$  શોધો..

<b>Q.4</b>		<b>04</b>
(a) (1) જો $A = \begin{bmatrix} 1 & -1 & 1 \\ 2 & -1 & 0 \\ 1 & 0 & 1 \end{bmatrix}$ તો $A^{-1}$ શોધો.		
(2) આપેલા સમીકરણ નો શ્રેણીકની મદદથી ઉકેલ શોધો, $3x-y=1$ અને $x+2y=5$ .		<b>03</b>
(b) (1) બળો $(1,2,1)$ અને $(2,-1,0)$ ની અસર તળે એક કણ નું બિન્ડુ $(-1,2,1)$ થી બિન્ડુ $(2,3,-1)$ સુધી સ્થાનાંતર થાય છે. થયેલ કાર્ય શોધો.		<b>04</b>
(2) જો $\bar{a} = (1,1,1)$ , $\bar{b} = (2,1,2)$ , $\bar{c} = (-1,0,3)$ તો $ 2\bar{a} + \bar{b} - \bar{c} $ શોધો		<b>03</b>
<b>Q.5</b>		
(a) (1) $\bar{a} = (3,1,2)$ અને $\bar{b} = (2, -2, 4)$ ને એકમ લંબ સદિશ શોધો.		<b>04</b>
(2) $\bar{a} = (1, 2, 4)$ અને $\bar{b} = (3, 1, 2)$ વચ્ચે નો ખૂણો શોધો.		<b>03</b>
(b) (1) સાબિત કરો કે $\cot \frac{\pi}{20} \cot \frac{3\pi}{20} \cot \frac{5\pi}{20} \cot \frac{7\pi}{20} \cot \frac{9\pi}{20} = 1$		<b>04</b>
(2) સાબિત કરો કે $\frac{\sec \theta + 2 \sin \theta}{\sin \theta + \cos \theta} = 1 + \tan \theta$		<b>03</b>
<b>Q. 6</b>		
(a) (1) $y = \sin x$ , $-\frac{\pi}{2} \leq x \leq \frac{\pi}{2}$ નો આલેખ દોરો.		<b>04</b>
(2) સાદુકૃપ આપો $\frac{\sin\left(\frac{\pi}{2}-\theta\right)}{\cos(\pi-\theta)} + \frac{\tan\left(\frac{\pi}{2}+\theta\right)}{\cot(\pi+\theta)} + \frac{\cosec\left(\frac{\pi}{2}+\theta\right)}{\sec(\pi+\theta)}$		<b>03</b>
(b) (1) સાબિત કરો કે $\cos A \sin(B-C) + \cos B \sin(C-A) + \cos C \sin(A-B) = 0$		<b>04</b>
(2) સાબિત કરો કે $\frac{1 + \sin 2A - \cos 2A}{1 + \sin 2A + \cos 2A} = \tan A$		<b>03</b>
<b>Q. 7</b>		
(a) (1) $y = \cos x$ , $0 \leq x \leq \pi$ નો આલેખ દોરો.		<b>04</b>
(2) સાબિત કરો કે $\frac{\cos A + \cos 3A + \cos 5A}{\sin A + \sin 3A + \sin 5A} = \cot 3A$		<b>03</b>
(b) (1) લઘુકોણ $\Delta ABC$ માટે પ્રમાણિત સંકેતમાં $\sin$ નો નિયમ સાબિત કરો.		<b>04</b>
(2) સાબિત કરો કે $\tan^{-1}\left(\frac{1}{3}\right) + \tan^{-1}\left(\frac{1}{7}\right) = \tan^{-1}\left(\frac{1}{2}\right)$		<b>03</b>

\*\*\*\*\*